

ફલેમો વાડી

તમારા પડોશ ની વાડી

ટોરોન્ટો શહેર ની ઉત્તર પૂર્વ માં ફલેમિંગ્ડન પાર્ક (ઉદ્યાન) વિસ્તારમાં ફલેમો વાડી અડધો એકર ની શહેરી વાડી છે | શહેરના ખેતીવાડીના પ્રાકૃતિક-દૃશ્યમાં એક અનન્ય ઉમેરો, ફલેમો વાડી સમુદાય-વિકસિત અને સમુદાયની માલિકીની છે |

ફલેમો વાડી માં શું થાય છે?

શહેરના વ્યાવસાયિક બિન-નફાકારક ફૂડશેરના કર્મચારીઓ દ્વારા ખેતરના અડધા ભાગની સંભાળ રાખવામાં આવશે, જે સ્વયંસેવક પ્રોગ્રામ દ્વારા રહેવાસીઓની સહાયથી ખોરાક(સાક ભાજી, ફળ આદિ) ઉગાડશે અને પાક લેશે | તે પાકમાંથી પેદા થનારા ઉત્પાદનનું વિતરણ ફલેમિંગ્ડન પાર્ક (ઉદ્યાન) વિસ્તારમાં રહેનાર સમુદાયમાં કરવામાં આવશે.

અન્ય અડધી વાડી સ્થાનિક સમુદાયના ઉગાડનારાઓ માટે જામિન ને 5 સમાન ભાગે પ્લોટને સમર્પિત હશે જે સૂક્ષ્મ વાવેતર (માઇક્રો ફાર્મ) ઉદ્યોગો ચલાવશે. જો તમને ઉગાડતો પાક (ખોરાક) પસંદ છે, તો તમે તમારા સમુદાયમાં સ્થાનિક તાજી ઉપજ માં મદદ (ફાળો) આપવા માંગો છો, અને પૂરક આવક પણ મેળવી શકો છો, કૃપા કરીને સમુદાયના ખેડૂત કાર્યક્રમ માં ભાગ લેવા માટે અરજી કરો.

નિયમિત પણે તપાસ કરો - અમારી પાસે બાળકો અને વયસ્ક લોકો માટે નિયમિત પ્રસંગો (ઇવેન્ટ્સ), કાર્યાસાલા (વર્કશોપ) અને ટૂર (પ્રવાસ) પણ હશે

ફલેમો વાડી કોણ છે?

ફલેમો વાડી ફલેમિંગ્ડન આરોગ્ય કેન્દ્ર અને ફૂડશેર ટોરોન્ટો વચ્ચેના સહયોગનું પરિણામ છે, જેમાં સિટી ઓફ ટોરન્ટો, વેસ્ટન ફેમિલી ફાઉન્ડેશન, પાર્ક પીપલ્સ અને લાઇવ ગ્રીનનો સહયોગ છે. ઓન્ટારિયો ટ્રિલિયમ ફાઉન્ડેશને 2015-2016 માં પ્રારંભિક સમુદાય-નિર્દેશિત આયોજનને ભંડોળ પૂરું પાડ્યું હતું.

ટોરોન્ટો શહેર અને ટોરોન્ટો શહેરી ઉગાડનાર ફળો અને શાકભાજીના પાકને ઉગાડવા માટે વિદ્યુત પરસાળ (હાઇડ્રો કોરિડોર) નો ઉપયોગ કરવા માટે સમુદાય સંબંધ અને ઉદ્યોગસાહસિક વિકાસ (કમ્યુનિટી એન્ગેજમેન્ટ એન્ડ આંત્રપ્રિન્યોરિયલ ડેવલપમેન્ટ) (સીઇઇડી) યોજના પર સહયોગ કરી રહી છે. આ પ્રાયોગિક પહેલ માટે પસંદ કરેલા બે સ્થળમાંથી એક ફલેમિંગ્ડન પાર્ક પણ છે.

ફલેમો વાડી ને વિકસિત ટકાઉ ફાર્મ અને સમુદાયની માલિકીની જગ્યામાં વિકસાવવા માટે સ્થાનિક વિસ્તારના સભ્યોની બનેલી એક સંચાલન સમિતિની રચના કરવામાં આવી છે.

અને તમે! તમારું ફલેમો વાડી પણ અને અમે તમારી સાથે જોડાવાની રાહ જોવી રહ્યા છી.

વધારે શોધો

સમુદાયના ખેડૂત બનવા માટે અરજી કરો અથવા www.flemofarm.ca પર સ્વયંસેવક તરીકે સાઇન અપ કરો

Follow @FlemoFarm on

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અથવા ટ્વિટર પર @FlemoFarm ને અનુસરો.
[Facebook](#), [Instagram](#), or [Twitter](#).

પ્રશ્નો, ટિપ્પણીઓ અથવા ચિંતાઓ માટે:

flemofarm@gmail.com

Mussarat Community Health Worker, Flemington Health Centre 647-465-0567

મુસરત સમુદાય આરોગ્ય કાર્યકર, ફલેમિંગટન આરોગ્ય કેન્દ્ર 647-465-0567

Carl Flemo Farm Coordinator, FoodShare 416-363-6441 x211

કાર્લ ફલેમો વાડી સંયોજક, ફૂડશેર 416-363-6441 x211